

અગત્યની સૂચના (Advt. No. SPIPA-202122-1)

યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૨ (IAS, IPS, IFS etc.) તેમજ બીજી ગ્રુપ-“A” કેન્દ્રીય

સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૧-૨૨

સંસ્થા ધ્વારા યુ.પી.એસ.સી. ધ્વારા લેવાનાર સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૨ની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૧-૨૨ માટેની પ્રથમ તબક્કાની વૈકલ્પિક પરીક્ષાનું આયોજન તા.૧૨/૦૮/૨૦૨૧, ગુરુવારના રોજ અને બીજા તબક્કાની નિબંધ કસોટીનું આયોજન તા.૧૩-૦૮-૨૦૨૧, સોમવારના કરવામાં આવેલ.

તમામ ઉમેદવારોએ નીચે જણાવેલ સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના તાલીમકેન્દ્રો માટે પસંદગીક્રમાંક (Center Preferences) આપેલ હતા.

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન (સ્પીપા), અમદાવાદ	પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, વડોદરા
ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ	પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, સુરત
પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, અમદાવાદ	પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, રાજકોટ

બીજા તબક્કાની નિબંધ કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને જણાવવાનું કે, ઉપર મુજબના તાલીમકેન્દ્રોના પસંદગી મુજબના ઓછામાં ઓછા એક (૦૧) તથા વધુમાં વધુ છ(૦૬) કેન્દ્રોની પસંદગી (Centre Preference) ઉમેદવારે ફરજિયાત તા.૦૬-૧૦-૨૦૨૧(બપોરે ૦૪.૦૦ કલાકથી) થી તા.૧૦-૧૦-૨૦૨૧ (રાત્રિના ૨૩:૫૯) સુધીમાં અચૂકપણે ઓજસની વેબસાઈટ (www.ojas.gujarat.gov.in – Call letter/Preference –

Secondary Exam Call letter/Preference) પર અથવા નીચે દર્શાવેલ લિંક પર જઈને આપવાના રહેશે. ઉમેદવારે અગાઉ સેન્ટર પ્રેફરન્સ આપ્યા હોય તેઓએ પણ ફરીથી સેન્ટર પ્રેફરન્સ ફરજિયાત આપવાનાં રહેશે. ત્યારબાદ તાલીમકેન્દ્રો માટે પસંદગીક્રમાંક (Center Preferences) માટે અન્ય કોઈ તક આપવામાં આવશે નહીં. ઉમેદવારોએ સેન્ટર પ્રેફરન્સ કાળજીપૂર્વક ભરવાના રહેશે ત્યારબાદ સેન્ટર પ્રેફરન્સને બદલવા અંગેની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

ઉમેદવારના મેરીટ નંબર, આપેલ તાલીમકેન્દ્રનો પસંદગીક્રમ તથા સરકારશ્રીની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ અનામત કક્ષાના ઉમેદવાર માટેની અનામત જગ્યાઓ તેમજ જે તે કેન્દ્ર ખાતેની જગ્યાની ઉપલબ્ધતા ને ધ્યાને લઈ મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવાર જે તાલીમકેન્દ્ર ખાતે પ્રવેશ લેવા માંગતા હોય તે તાલીમકેન્દ્રનો પસંદગી ક્રમ (ઓછા માં ઓછા ૦૧ સેન્ટર પ્રેફરન્સ અને વધુમાં વધુ ૦૬ સેન્ટર પ્રેફરન્સ) આપવાનો રહેશે. તાલીમકેન્દ્રની પસંદગી મુજબના ક્રમાનુસાર સેન્ટર પ્રેફરન્સ આપ્યા બાદ કોઈપણ પ્રકારના બદલાવ માટેની માંગણી કે રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

ઉમેદવારે આપેલ પસંદગીક્રમ પૈકી પ્રથમ પસંદગી ક્રમ (1st Preference) આપેલ તાલીમકેન્દ્ર ઉપર જણાવેલ બાબતોને ધ્યાને લેતાં જગ્યા ખાલી ન હોય તેવાં સંજોગોમાં ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ પછીના પસંદગીક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવશે.

લિંક:- <https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUBWdmhKlwjaHr/CUNi26A==>

Sd/-

તારીખ: ૦૬/૧૦/૨૦૨૧

સ્થળ: અમદાવાદ

સંયુક્ત નિયામક, (સ્ટડી)

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા,

અમદાવાદ